



IDT (Integrated Device Technology)

Technology)



8N4SV76FC-0160CDI

ભાગ નંબર:	8N4SV76FC-0160CDI
ઉત્પાદક / બ્રાન્ડ:	IDT (Integrated Device Technology)
ઉત્પાદન વર્ણન	IC OSC VCXO 155.52MHZ 6-CLCC
માહિતી પત્ર:	1.8N4SV76FC-0160CDI.pdf 2.8N4SV76FC-0160CDI.pdf
RoH સ્થિતિ	હીડ ફ્રી / આરઓએચએસ સુસંગત
શિપ	હોંગ કોંગ
શિપમેન્ટ વે	DHL/Fedex/TNT/UPS/EMS

[અવતરણ માટે વિનંતી](#)

છબી સ્ક્રીનશોટ ડોઈ શહે છે. ઉત્પાદન વિગતો માટે વિશિષ્ટતાઓ જુઓ.













8N4SV76FC-0160CDI ની વિશિષ્ટતાઓ

ભાગ નંબર	8N4SV76FC-0160CDI
ઉત્પાદક	IDT (Integrated Device Technology)
વર્ણન	IC OSC VCXO 155.52MHZ 6-CLCC
હીડ ફ્રી સ્ટેટસ / આરઓએચએસ સ્ટેટસ	હીડ ફ્રી / આરઓએચએસ સુસંગત
ડેટા શીટ	1.8N4SV76FC-0160CDI.pdf 2.8N4SV76FC-0160CDI.pdf
વોલ્ટેજ - સપ્લાય	2.375 V ~ 2.625 V
વખો	VCXO
સપ્લાયર ઉપદ્રવ પેકેજ	6-CLCC (7x5)
સિરીઝ	FemtoClock® NG
પેકેજિંગ	Tray
પેકેજ / કેસ	6-CLCC
બ્રીજના નામો	IDT8N4SV76FC-0160CDI IDT8N4SV76FC-0160CDI-ND
ઓપરેટિંગ તાપમાન	-40°C ~ 85°C
માઉન્ટિંગ પ્રકાર	Surface Mount
ભેજ સંવેદનશીલતા સ્તર (એમએસએલ)	1 (Unlimited)
હીડ ફ્રી સ્ટેટસ / આરઓએચએસ સ્થિતિ	Lead free / RoHS Compliant
આવર્તન	155.52MHz
વિગતવાર વર્ણન	VCXO IC 155.52MHz 6-CLCC (7x5)
વર્તમાન - પુરવઠો	136mA
ગણતરી	-
આધાર ભાગ નંબર	IDT8N4SV76FC

સંબંધિત સ્પસ

IDT (Integrated Device Technology) 8N4SV76FC-0160CDI	8N4SV76FC-0160CDI ડિસ્ટ્રિબ્યુટર	8N4SV76FC-0160CDI સપ્લાયર
8N4SV76FC-0160CDI ભાવ	8N4SV76FC-0160CDI ચિત્રો	8N4SV76FC-0160CDI છબી
8N4SV76FC-0160CDI પીડીએફ ડેટાશીટ	8N4SV76FC-0160CDI ડાઉનલોડ ડેટાશીટ	8N4SV76FC-0160CDI ડેટાશીટ
8N4SV76FC-0160CDI સ્કોડ	8N4SV76FC-0160CDI ખરીદો	IDT (Integrated Device Technology) 8N4SV76FC-0160CDI ખરીદો
IDT (Integrated Device Technology) 8N4SV76FC-0160CDI	IDT (Integrated Device Technology) સપ્લાયર	IDT (Integrated Device Technology) વિતરક
IDT (Integrated Device Technology) 8N4SV76FC-0160CDI	IDT 8N4SV76FC-0160CDI	IDT (Integrated Device Technology) 8N4SV76FC-0160CDI
IDT, Integrated Device Technology Inc 8N4SV76FC-0160CDI	Integrated Device Technology (IDT) 8N4SV76FC-0160CDI	

સંબંધિત વસ્તુઓ

 <p>8N4SV76FC-0162CDI8 ઉત્પાદકો: IDT (Integrated Device Technology) વર્ણન: IC OSC VCXO 100MHZ 6-CLCC ઉપલબ્ધ છે: Out stock</p> <p style="text-align: center;">RFQ</p>	 <p>8N4SV76FC-0157CDI8 ઉત્પાદકો: IDT (Integrated Device Technology) વર્ણન: IC OSC VCXO 100MHZ 6-CLCC ઉપલબ્ધ છે: Out stock</p> <p style="text-align: center;">RFQ</p>
 <p>8N4SV76FC-0160CDI8 ઉત્પાદકો: IDT (Integrated Device Technology) વર્ણન: IC OSC VCXO 155.52MHZ 6-CLCC ઉપલબ્ધ છે: Out stock</p> <p style="text-align: center;">RFQ</p>	 <p>8N4SV76FC-0158CDI8 ઉત્પાદકો: IDT (Integrated Device Technology) વર્ણન: IC OSC VCXO 166.62875MHZ 6-CLCC ઉપલબ્ધ છે: Out stock</p> <p style="text-align: center;">RFQ</p>
 <p>8N4SV76FC-0157CDI ઉત્પાદકો: IDT (Integrated Device Technology) વર્ણન: IC OSC VCXO 100MHZ 6-CLCC ઉપલબ્ધ છે: Out stock</p> <p style="text-align: center;">RFQ</p>	 <p>8N4SV76FC-0161CDI ઉત્પાદકો: IDT (Integrated Device Technology) વર્ણન: IC OSC VCXO 212MHZ 6-CLCC ઉપલબ્ધ છે: Out stock</p> <p style="text-align: center;">RFQ</p>
 <p>8N4SV76FC-0161CDI8 ઉત્પાદકો: IDT (Integrated Device Technology) વર્ણન: IC OSC VCXO 212MHZ 6-CLCC ઉપલબ્ધ છે: Out stock</p> <p style="text-align: center;">RFQ</p>	 <p>8N4SV76FC-0159CDI ઉત્પાદકો: IDT (Integrated Device Technology) વર્ણન: IC OSC VCXO 100MHZ 6-CLCC ઉપલબ્ધ છે: Out stock</p> <p style="text-align: center;">RFQ</p>
 <p>8N4SV76FC-0159CDI8 ઉત્પાદકો: IDT (Integrated Device Technology) વર્ણન: IC OSC VCXO 100MHZ 6-CLCC ઉપલબ્ધ છે: Out stock</p> <p style="text-align: center;">RFQ</p>	 <p>8N4SV76FC-0162CDI ઉત્પાદકો: IDT (Integrated Device Technology) વર્ણન: IC OSC VCXO 100MHZ 6-CLCC ઉપલબ્ધ છે: Out stock</p> <p style="text-align: center;">RFQ</p>
 <p>8N4SV76FC-0158CDI ઉત્પાદકો: IDT (Integrated Device Technology) વર્ણન: IC OSC VCXO 166.62875MHZ 6-CLCC ઉપલબ્ધ છે: Out stock</p> <p style="text-align: center;">RFQ</p>	 <p>8N4SV76FC-0163CDI ઉત્પાદકો: IDT (Integrated Device Technology) વર્ણન: IC OSC VCXO 81MHZ 6-CLCC ઉપલબ્ધ છે: Out stock</p> <p style="text-align: center;">RFQ</p>